

B.Com. Semester - 1 (CBCS) Examination
Feb/Mar. -2021 (NEW COURSE)
ACCOUNTING - 1(ELECTIVE-1)

Time: 1:30 Hours

Marks: 42

Instructions:

1. Figures to the right indicate marks.
2. There are five questions in the question paper.
3. Answer any three of the following questions.

પ્રશ્ન.૧ A અને B સરખા પ્રમાણમાં નફો નુકશાન વહેંચતા એક સોલિસીટર પેઢીના ભાગીદારો છે. તેમનું (૧૪) 31-03-2014 ના રોજનું કાયું સરવૈયું નીચે પ્રમાણે છે.

વિગત	રકમ	વિગત	રકમ
વાહનો	3,60,000	લેણદારો	6,000
કોમ્પ્યુટર	1,80,000	અસીલ એડવાન્સ	30,000
અસીલ પરચૂરણ ખર્ચની ખાતાવહી	45,000	ફી	7,50,000
પરચૂરણ ખર્ચ	21,000	કુલ મૂડી	3,00,000
ઈન્જર્નલ લવાજમ	27,000		
કુરીયર ચાર્જ	7,500		
સ્ટેશનરી છપામણી	4,500		
મુસાફરી ખર્ચ	6,000		
ઓફિસ ખર્ચ	60,000		
દેવાદારો	30,000		
સ્ટાફ પગાર	90,000		
બેન્ક (પેઢી)	75,000		
બેન્ક (અસીલ)	30,000		
અસીલોના ખાતા (બાકી ફી)	1,50,000		
	10,86,000		10,86,000

નીચેની વિગતો ધ્યાનમાં લઈ 31-3-2014 ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરો.

1. બંને ભાગીદારોની મૂડી 3:2 ના પ્રમાણમાં હતી.
2. મૂડી પર 6% વ્યાજ ગણો.
3. રૂ. 4,500 અસીલ વતી ચૂકવેલ જે પરચૂરણ ખર્ચ ખાતે નોંધેલ છે.
4. વાહનો પર 10% અને કમ્પ્યુટર પર 5% ઘસારો ગણો.
5. એક અસીલ પાસેથી પરચૂરણ ખર્ચ પેટે રૂ. 15,000 મળેલ તેનો સમાવેશ અસીલ એન્ડવાન્સમાં થયેલ છે.
6. અધુરા કામની બાકી રૂ. 60,000 હતી.

પ્રશ્ન.૨ શ્રી વિજયે 1-1-2004 ના રોજ શ્રી જય પાસેથી એક યંત્ર ભાડે ખરીદ પધ્ધતિથી ખરીદયુ. આ અંગેની શરતો નીચે મુજબ હતી. (૧૪)

1. યંત્રની રોકડ કિંમત 1,60,000
2. તા. 1-1-2004 ના રોજ ચૂકવેલ રકમ 60,000
3. તા. 31-12-2004 ના રોજ ચૂકવેલ રકમ 50,000
4. તા. 31-12-2005 ના રોજ ચૂકવેલ રકમ 36,000
5. તા. 31-12-2006 ના રોજ ચૂકવેલ રકમ 33,000
6. વ્યાજનો દર વાર્ષિક 10% છે.
7. દર વર્ષ મૂળકિંમત પર 10% ઘસારો ગણવાનો છે.

વિજયના ચોપડામાં યંત્ર ખાતુ અને જયનુ ખાતું તૈયાર કરો.

પ્રશ્ન.૩ એક જહાજ (વહાણ) “જલદીપ” તા.01-11-2018ના રોજ મુંબઈથી કંડલાની સફર કરી તા.26-03-2019ના રોજ પરત ફર્યું. (૧૪)

સફરની માહિતી નીચે મુજબ છે.

પગાર (વાર્ષિક)	Rs.15,000
કોલસો	Rs.15,000
કેપ્ટનનો પગાર (ત્રિ-માસિક)	Rs.4,500
વહિવટી ખર્ચા (અર્ધ-વાર્ષિક)	Rs.10,000
વહાણનો વીમો (માસિક)	Rs.1,000
પરચુરણ ખર્ચા	Rs.10,000
વપરાયેલ સ્ટોર્સ	Rs.4,500
જતી વખતનું નૂર	Rs.50,000
વળતી વખતનું નૂર	Rs.35,000
એડ્રેસ કમિશન	1%
પ્રાઇમેજ	2%
નૂરનો વીમો	3%
મેનેજરને કમિશન (નૂરના)	6%
વહાણનો ઘસારો	5%
વહાણની કિંમત	Rs.4,00,000 છે.

સફરખાતું તૈયાર કરો.

પ્રશ્ન.૪ એક કારખાનામાં સ્ટોર્સ અહેવાલ પરથી માર્ચ-2019 ના માસમાં “X” વસ્તુની નીચેની માહિતી પ્રાપ્ત થાય છે. (૧૪)

માર્ચ 2019	વિગત	કિ.ગ્રા.	ભાવ(Rs.)
1	શરૂનો સ્ટોક	2,500	2=00
4	પૂરો પાડેલ માલ	1,300	-
6	પૂરો પાડેલ માલ	200	-

13	ખરીદી	3,000	4=00
17	પૂરો પાડેલ માલ	1,000	-
21	પૂરો પાડેલ માલ	500	-
26	ખરીદી	1,000	5=00
30	પૂરો પાડેલ માલ	500	-

તા. 21-3-2019 ના રોજ સ્ટોકની ચકાસણી કરતા 50 Kg માલની ઘટ્ટ માલુમ પડી.
માલસામાન ખાતાવહી (સ્ટોકપત્રક) FIFO અને LIFO પદ્ધતિથી તૈયાર કરો.

પ્રશ્ન.૫ કોઇપણ બે ના જવાબ આપો.

(૧૪)

- રોકડના ધોરણે હિસાબો અને વેપારી ધોરણે હિસાબો વચ્ચેનો તફાવત આપો.
- ભાડે ખરીદ પદ્ધતિ અને હપતા ખરીદ પદ્ધતિ વચ્ચેનો તફાવત આપો.
- ઇન્વેન્ટરીના હિસાબ રાખવાના ફાયદા
- સફરના હિસાબોમાં નીચેના શબ્દો સમજાવો.
(A) પ્રાઇમેજ (B) એડ્રેસ કમિશન.

ENGLISH VERSION

Q.1 A and B are the partners of a solicitor firm sharing profit equally. On 31-03-2014 the trial Balance sheet as under.

(14)

Particulars	Amount	Particulars	Amount
Vehicles	3,60,000	Creditors	6,000
Computer	1,80,000	Client advance	30,000
Client sundry Exp. Ledger A/c	45,000	Fees	7,50,000
Sundry Exp.	21,000	Total capital	3,00,000
E-Journal subscribed	27,000		
Courier charge	7,500		
Stationary and Printing Exp.	4,500		
Travelling Exp.	6,000		
Office Expense	60,000		
Debtors	30,000		
Staff salary	90,000		
Bank (Firm)	75,000		
Bank (client)	30,000		
Client A/c (Fees O/s)	1,50,000		
	10,86,000		10,86,000

From the following prepare Final Accounts for the year ending 31-3-2014.

- Capital of Both the partners was in 3:2 ratio.
- Allow 6% interest on capital.
- Rs. 4,500 paid for clients are recorded in sundry expenses A/c.
- Provide 10% depreciation on vehicles and 5% on computers.
- Rs. 15,000 received from a client for sundry exp. are included in client Advance A/c.
- At the end of the year, incomplete work was of Rs.60,000.

- Q.2 Shri Vijay purchased a Machine on hire purchase system from Shri Jay on 01-01-2004 the conditions were as below. (14)

1. Cash Price of machine Rs. 1,60,000
2. Paid on 01-01-2004 Rs. 60,000
3. Paid on 31-12-2004 Rs. 50,000
4. Paid on 31-12-2005 Rs. 36,000
5. Paid on 31-12-2006 Rs. 33,000
6. The rate of interest 10% per annual.
7. Charge 10% depreciation P.a. on cash price
[straight line method]

Prepare machine A/c. & Jay A/c in Vijay's Books.

- Q.3 A ship "JALDIP" voyaged on 1/11/2018 from Bombay and return Kandla on 26-03-2019. (14)

Details are as under:-

Salaries (Annual)	Rs.15,000
Coal	Rs.15,000
Captain Salaries (For three month)	Rs.4,500
Administrative Exp. (Half yearly)	Rs.10,000
Ship Insurance (Monthly)	Rs.1,000
Sundry Exp.	Rs.10,000
Stores used	Rs.4,500
Freight for outword Journey	Rs.50,000
Freight for returned Journey	Rs.35,000
Address Commission	1%
Primage	2%
Freight insurances	3%
Manager's Commission on Freight	6%
Depreciation on Ship	5%
Value of Ship	Rs.4,00,000
Prepare Voyage Accountant (A/c)	

- Q.4 The following information regarding item "X" for March-2019 from the stores of a Factory. (14)

March 2019	Particulars	Kg.	Rs.
1	Opening stock	2,500	2=00
4	Issued	1,300	-
6	Issued	200	-
13	Purchased	3,000	4=00
17	Issued	1,000	-
21	Issued	500	-
26	Purchased	1,000	5=00
30	Issued	500	-

The stock verification revealed a shortage of 50 Kgs. on 21-03-2019

Prepare store ledger as per FIFO and LIFO method.

- Q.5 Answer any two. (14)

1. Difference between Cash basis and mercantile basis.
2. Difference between Hire purchase system and Installment system.
3. Advantages of Holding Inventory.
4. Explain the below wards in voyage Accounting.
(A) Primage (B) Address Commission.
